

# પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના ના નિયમો

## સ્કીમ ની વિગત વાર માહિતી

- સ્કીમ ની હેઠળ એક વર્ષ નું વીમા નું કવચ મળશે જે દર વર્ષે રિન્યૂ કરવાનું રહેશે.
- આકસ્માતીક વીમા નો લાભ અકસ્માત મૃત્યુ અથવા ખોટ ખાપણ મા રહેશે
- આ યોજના નું અમલીકરણ જનરલ ઇન્સ્યોરન્સ કંપની યા તો તેના જેવી સવલત વાળી બીજી વીમા કંપનીઓ જેઓ સમાન શરતોથી સંચાલિત અને જરૂરી મંજૂરી લઈ બેંકો સાથેના સંગઠનમાં રહી ઉપલબ્ધ કરશે
- આ યોજના હેઠળ ભાગ લેનાર બેંકો પોતાના ગ્રાહકો નો સમાવેશ કરવા કોઈ પણ વીમા કંપની સાથે જોડાણ કરી શકશે.

## કેવા લાભાર્થી નો સમાવેશ થઈ શકે.

- બધાજ બચત ખાતેદાર કે જેમની ઉંમર 18 થી 70 વર્ષ હોય તેવા લોકો આ યોજના મા જોડાઈ શકશે.
- વિવિધ બેંક મા તેમજ એક થી વધારે એકજ બેંકની શાખાઓમા બચત ખાતા ધરાવનાર આસામીઓ કોઈ પણ એકજ બેંક ના એકજ બેંક ખાતા મા લાભ મળી શકશે. આ ખાતામા KYC માટે આધાર કાર્ડ પ્રાથમિક જરૂરત રહેશે.
- સ્કીમ ની મુદત - આ યોજના મા સમાવેશ થવાનો સમય ગાળો 1 જૂન થી 31 મે સુધીનો રહેશે જેમાં નિયત નમૂનામા ફોર્મ ભરી લાભાર્થી એ 31 મે સુધીમાં બેંક મા જમા કરવાનું રહેશે જેના આધારે બેંકો દ્વારા વીમાનું પ્રીમિયમ લાભાર્થી ના ખાતા માથી ઉધારી ને વીમા કંપની ને મોકલવાનું રહેશે પ્રથમ વર્ષે આ મુદત 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવેલ છે જે લોન્ય માટે ભારત સરકાર કદાચ તે મુદત 3 માસ એટલેકે 30 નવેમ્બર 2015 સુધી વધારી શકે છે.
- આ યોજના મા મુદત પૂરી થયા બાદ જોડાવા માગતા ખાતા ધારક નો સમાવેશ વિશેષ સરતોને આધીન કરી શકશે જેમા લાભાર્થી એ વીમાનું આખા વર્ષે નું પૂરું પ્રીમિયમ એક સાથે ભરવાનું રહેશે.
- તેમ છતા ખાતેદાર લાંબા સમય માટે આ યોજના મા જોડાવા માટે લાંબા ગાળા નો ઓપ્શન અનુભવ ને આધારિત જેતે વખત ની સ્કીમ ની શરતો પ્રમાણે રહેશે
- કોઈ પણ ખાતા ધારક આ યોજના મા ગમે તે સમયે નીકળી શકશે તેમજ ફરિથી ઉપરોક્ત પદ્ધતિ થી જોડાઈ શકશે. તેમજ જો સ્કીમ ચાલુ રહે તો ભવિષ્ય મા ન જોડાયેલા ખાતા ધારકો પણ ઉપરોક્ત પદ્ધતિ થી જોડાઈ શકશે

## સ્કીમ ના લાભ નીચેના કોઠા મા જણાવેલા છે

અનુક્રમ નંબર	લાભ	મહત્તમ લાભ ની રકમ
A	મરણ થયે	રૂપિયા 2 લાખ સુધી
B	અકસ્માત મા બંને આખ અથવા નજર જતી ગુમાવયે અથવા બંને હાથ કે પગ ગુમાવયે અથવા બિન ઉપયોગી થયે	રૂપિયા 2 લાખ સુધી
C	એક આખની નજર ગુમાવયે અથવા એક હાથ કે પગ બિન ઉપયોગી થયે	રૂપિયા 1 લાખ સુધી

વીમાના પ્રીમિયમ ની રકમ : રૂપિયા 12 પ્રતિ ખાતેદાર દીઠ પ્રતિ વર્ષ રહેશે જે રકમ ખાતેદારના બચત ખાતા માથી એક સાથે ઓટો ડેબિટ ફેસિલિટી થી દર વર્ષે 1 જૂન કે તેની પહેલા ઉધારી લેવાશે. જો ઓટો ડેબિટ 1 જૂન બાદ થયેલ હોય તેવા ખાતેદાર ના ખાતા મા વિમાનો લાભ ત્યારપછી ના મહિનાની 1 તારીખ થી રહેશે

પ્રીમિયમ ની રકમ દર વર્ષે થયેલ કલેમ ની રકમ ને આધારીત નક્કી કરવામાં આવશે. છતા પણ મોટા ભાગે અનિવાર્યે સંજોગો શિવાય વિમાની રકમ પહેલા 3 વર્ષે દરમિયાન ન વધે તેવું જોવામાં આવશે.

## લાયકાતની શરતો

જે બચત ખાતે દરો કે જેમની ઉમર 18 પૂરા થી 70 વર્ષે ની વચે હોય અને જેઓ એ આ સ્કીમ મા જોડાવા માટે ઓટો ડેબિટ ની બાહેંધરી આપેલ હોય તેવા ખાતેદરો ઉપરોક્ત સરતો ને આધીન જોડાઈ સકશે

## માસ્ટર પોલિસી હોલ્ડર

માસ્ટર પોલિસી જોડાયેલ બેંકના નામે માસ્ટર પોલિસી ખાતેદરો વતી રહેશે. જે તે જનરલ વીમા કંપની એ જોડાયેલ બેંક ની સાથે રહી યોજના નું અમલીકારણ તેમજ ક્લેમ નું નિવારણ સરળ રીતે કરવાનું રહેશે.

## વીમા યોજના માથી મુક્તિ (Termination of cover)

ખાતેદાર નીચે જણાવેલા સંજોગો માં વિમા પાત્ર થઈ સકશે નહીં

1. 70 વર્ષે પૂરા થયા બાદ
2. બેંક બચત ખાતું બંધ થયે અથવા ખાતામાં અપૂરતા બેલેન્સ થયે
3. જો એક કરતા વધારે ખાતા માથી પ્રીમિયમ વીમા કંપની ને મળ્યે કોઈ એકજ ખાતા ના વીમાનો લાભ રહેશે અને મળેલું વધારનું પ્રીમિયમ પરત કરવામાં આવશે નહીં.
4. જો અપૂરતા બેલેન્સ કે અન્ય કોઈ ટેકનિકલ કારણોસર કે વહીવટી કારણસર સમય સર પોહેચેલ ન જોવા ના કારણે જોખમ રદ થયેલ હોય તો આખા વર્ષ નું પૂરું પ્રીમિયમ ભરીએ ફરીથી નિયત નિયમ આધીન યોજના માં ફરીથી જોડાઈ શકાશે આ સમય ગાળા દરમિયાન ખાતેદાર નું જોખમ નો સમાવેસ કરવામાં આવશે નહીં અને તેને ફરીથી ચાલુ રાખવું કે નહીં તેનો સંપૂર્ણ હક વીમા કંપની નો રહેશે.
5. જોડાયેલ બંકે વર્ષ પૂરું થયે દર વર્ષે સકયે હોયતો મે મહિના માં ખાતેદાર ના ખાતા માથી વીમાના પ્રીમિયમ ની રકમ ઉધારીને વીમા કંપની ને તેજ માસ માં મોકલશે.

## યોજના નું સંચાલન

આ યોજના નું સંચાલન જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ઉપરોક્ત નીતિ નિયમો તેમજ પદ્ધતિ હેઠળ કરવામાં આવશે વીમાનું પ્રીમિયમ બચત ખાતેદારો ના ખાતા માથી ઉધારી ને વીમા કંપની ને મોકલવાની જવાબદારી જે તે બેંકો ની રહેશે. બચત ખાતે દરો પાસે થી એનરોલમેંટ ફોર્મ (અરજી ફોર્મ ) તેમજ ઓટો ડેબિટ હેંધરીખત મળવી ની જેતે બેંક પોતાની પાસે રાખવાનું રહેશે અને ક્લેમ સેટલમેંટ વખતે વીમા કંપની માગે તો તેમને આપવાનું રહેશે.

વીમા કંપની ને વીમા આધારિત કોઈ પણ સાધનિક કાગળ માંગવાનો ગમે ત્યારે માંગવાનો અબાધિત હક્ક રહેશે

મળેલી Acknowledgement રસીદ ને વીમાનું સર્ટિફિકેટ ગણવાનું રહેશે.

આ સ્કીમ ની મુલવણી અનુભવ ના આધારિત દર વર્ષ કરવામાં આવશે અને તે મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવાના રહેશે

## વીમાના પ્રીમિયમ ની વહેંચણી

- રૂપિયા 10 પ્રતિ વર્ષ પ્રતિ ખાતા ધારક દિઠ વીમા કંપની ને આપવાના રહેશે.
- રૂપિયા 1 પ્રતિ વર્ષે પ્રતિ ખાતા ધારક દીઠ બેંક મિત્ર અથવા માઇક્રો / કોર્પોરેટ એજેન્ટ
- રૂપિયા 1 પ્રતિ વર્ષે પ્રતિ ખાતા ધારક દીઠ જોડાયેલ બેંક ને વહીવટી ખર્ચ પેટે આપવાનો રહેશે

સ્કીમ ની શરૂઆત અંદાજીત તારીખ 1 જૂન 2015 થી કરવામાં આવશે, જેમનું વાર્ષિક રિન્યૂ તેના પછીના વર્ષ ની જૂન ની 1 તારીખ રહેશે.

ઉપરોક્ત સ્કીમ પછીના વર્ષ ની શરૂઆત પહેલા પરિષથી વશાત જરૂર જણાંએ બંધ કરી શકાશે.